

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૧/૨૦૧૮ સોમવાર

### અમદાવાદ શહેર પોલીસ સમાચાર

#### નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૬ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૧૩૦ લીટર, ૯૬ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૨ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૪ કેસ કરી, ૧૭ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૨૨,૭૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

#### તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

#### વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૫૪/૧૮

**મણિનગર:** સુભાષભાઈ પરસાદારામ યાદવ (ઉ.વ.૫૧)(રહે,કોર્નિયા એપાર્ટમેન્ટ, ગુડલક હોલની પાછળ, દક્ષીણી સોસાયટી, મણિનગર) એ તા.૭/૧/૧૮ રોજ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૧/૧૨/૧૭ ના કલાક ૧૧/૦૦ થી તા.૪/૧/૧૮ સુધીનાં સમયગાળા દરમિયાન મણિનગર ICICI બેંક આગળ, સરદાર પટેલ હોસ્પિટલ પાસે તથા બાટા શો-રૂમ આગળ આરોપી રાજુ અગ્રવાલ નામનો માણસ તથા એક હકીમજી (જેના નામ-સરનામા જાણવા મળેલ નથી) ભેગામળી સુભાષભાઈ ને "ગળાની સ્કિન એલર્જી છે તે સારૂ થઈ જશે" તેમ કહી વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા ૨૦,૦૦૦/- તથા પાસઠ-પાસઠ હજારના બે ચેક લઈ જતા રહેલ તેમજ સુભાષભાઈની ઓફિસમાં કામ કરતા ચંદ્રકાંતભાઈ ને પણ "તેઓનો મંદબુદ્ધિ ટિકરો ત્રણ દિવસમાં સારો થઈ જશે તેમ કહી રોકડા રૂપિયા ૫૦,૦૦૦/- તથા એક ચેક લઈ જતા રહી બંને સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જી.સોલંકી ચલાવે છે.

#### વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૫૫/૧૮

**રામોલ :** રાકેશભાઈ ગોપીકુમાર યાદવ(ઉ.વ.૪૨) (રહે, હરીઓમ બંગ્લોઝ, રતનપુરા ગામ, માધવ સ્કુલ રોડ, વસ્ત્રાલ) એ તા.૫/૧/૧૮ ના કલાક ૨/૩૫ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક પોતાની આઈસર ગાડી ૧૧૧૦ એક્સ.પી.ગાડી નંબર જીજી.૦૧.ડી.ઝેડ.૦૨૧૩ કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની તા.૫/૧/૧૮ સવારનાં કોઈપણ સમયે કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ હતી. આ અંગેની ફરીયાદ રાકેશભાઈ યાદવે તા.૭/૧/૧૮ નારોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ઓ.ભરવાડ ચલાવે છે.

શહેરકોટડા: જયમલ સુર્યકાંત સોની (ઉ.વ.૨૩) (રહે. શાંતીનીકેતન એપાર્ટમેન્ટ સ્વામી નારાયણ મંદીર પાછળ શ્યામ શીખર બાપુનગર) એ અગમ્ય કારણસર તા.૭/૧/૧૮ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળોફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિલીપકુમાર વસંતલલ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઈસ્ટ: રમેશભાઈ કાંતીભાઈ (ઉ.વ.૧૮) (રહે. ભવાનીનગરનો ટેકરો ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૭/૧/૧૮ બપોરના ૪/૧૦ વાગ્યા પહેલા દધીચીબ્રિજ નીચે નદીમાં ડુબી જઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મોતીભાઈ તળજાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.